

સુરતમાં હવે બ્રાન્ડેડ ખાવાના ચુનાનું પણ ડુપ્લીકેટ કરવામાં આવ્યું, નકલી ચુનો વેચનાર ઝડપાયો આ ચુનાની બજારમાં મોટા પ્રમાણમાં માંગ હોવાને લઈને કેટલાક ઈસમો દ્વારા તે નામનો જ નકલી ચુનો બનાવી બજારમાં વેચાણ કરતા હતા

| December 30, 2020, 7:05 PM IST



કિર્તેશ પટેલ, સુરત : અત્યાર સુધી તમે અનેક વસ્તુ નકલી બજારમાં વેચાતી જોઈ હશે, પણ ખાવાનો ચુનો પણ બજારમાં નકલી વેચાય છે આવી વિગત મળતા આજે પોલીસે દરોડા પાડીને એક નકલી ચુનો બનાવી પેકિંગ કરતી ફેક્ટરી પર દરોડા પાડી એક ઈસમને લાખોના મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છે.

બજારમાં કોઈ પણ વસ્તુની માંગ વધતા તે વસ્તુમાં વધુ રૂપિયા કમાવા માટે કેટલાક લોકો તે નકલી બનાવી બજારમાં વેચાણ કરતા હોય છે, ત્યારે આવી અનેક નકલી વસ્તુ બજારમાંથી પોલીસ દ્વારા દરોડા પાડીને પકડી પાડવામાં આવી છે, ત્યારે હાલમાં સુરતની પુના પોલીસે બ્રાન્ડેડ ચુનાના નામથી નકલી ચુનો વેચનારને ઝડપી પાડ્યો છે.

અમદાવાદની જાણીતી કંપની સિદ્ધાંત ચુનાનું પાર્સલનું કામ મોટા પ્રમાણમાં ગુજરાતમાં કરાય છે. જોકે આ ચુનાની બજારમાં મોટા પ્રમાણમાં માંગ હોવાને લઈને કેટલાક ઈસમો દ્વારા તે નામનો જ નકલી ચુનો બનાવી બજારમાં વેચાણ કરતા હોવાની વિગત કંપનીના મલિક હિરેન પટેલને મળી હતી. જોકે માલિક દ્વારા સુરતની પુણા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, પુણા પોલીસની હદમાં આવેલ ગીતા નગર ખાતે વિજય ડિણવીયા નામનો ઈસમ છેલ્લા કેટલાક સમયથી તેમના નામે નકલી ચુના પેકિંગ કરીને બજારમાં વેચાણ કરે છે.

પોલીસે આ મામલે ફરિયાદ લઈને ચુના કંપનીના મલિકને સાથે રાખીને તેમના કહેવા પ્રમાણેના સરનામે દરોડા પાડ્યા હતા, જ્યાં વિજય ડિણવીયા પોલીસને મળી આવ્યો હતો. જોકે પોલીસે આ જગ્યા પરથી સિદ્ધાંત કંપનીના નામે નકલી ચુનાના પાઉચ, પ્રિન્ટિંગ પેકેજિંગ રોલ, ઓટોમેટિક પાઉચ પેકિંગ મશીન સહિતનો સમાન મળી આવતા પોલીસે આરોપી વિજયની ધરપકડ કરી તેના વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ તેની ધરપકડ કરી હતી. પોલીસે આ કેટલા સમયથી નકલી કારખાનું ચલાવીને કેટલી જગ્યા પર માલ સપ્લાય કરતો હતો, તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

Source: <https://gujarati.news18.com/photogallery/south-gujarat/surat-branded-food-lime-was-also-duplicated-in-surat-counterfeit-lime-seller-caught-kip-km-1059804-page-4.html>